

આઘરાઘટીમાં યોજાશે લિડરશીપ કોન્કલેવ

સિટી રિપોર્ટર  @ahm_cb

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગરમાં દુનિયાભરના જાણીતાં એકેડેમિશિયન્સ અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ્સ લિડરશીપ અને એકેડેમિક એક્સલેન્સ પર ચર્ચા કરશે. આ માટે ઈન્સ્ટિટ્યુટની પાંચમી એકેડેમિક એડવાઈઝરી કાઉન્સિલનું આયોજન 28મી ડિસેમ્બરે તેમજ 6ઠી લિડરશીપ કોન્કલેવનું આયોજન 29મી ડિસેમ્બરે કરાયું છે. આ બંને કાર્યક્રમોમાં અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટી, ક્લેમસન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વિસકોન્સિનમેડિસન, સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક અને અન્ય યુનિવર્સિટીઝ જેવી કે પોર્ટુગલની લિસબોન યુનિવર્સિટી ઈન્સ્ટિટ્યુટ અને દિલ્હીની આઈઆઈટીનાં જાણીતાં પ્રોફેસર્સ ભાગ લેશે. આ ઉપરાંત વિદેશ અને ભારતની જાણીતી કંપનીઓનાં મેનેજિંગ ડાયરેક્ટર્સ અને સીઈઓ પણ હાજરી આપશે. જેમાં ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને સપોર્ટ માટેનાં રિસોર્સિસ અંગેની ચર્ચ પણ થશે.